



રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા

www.rbi.org.in

www.rbi.org.in/hindi

e-mail: helpprd@rbi.org.in

પ્રેસ રિલીઝ ડિવીઝન, સેન્ટ્રલ ઓફિસ, પોસ્ટ બોક્સ નં. 406, મુખ્ય 400001
ફોન : 2266 0502 ફોક્સ : 2266 0358, 2270 3279

16 ઓગષ્ટ, 2004

બેંકના ગ્રાહકો માટે હવે આરટીજઅસ સેવા : આરબીઆઈ

આરબીઆઈ આજરોજ જણાવે છે કે તેની આરટીજઅસ સેવા, ભાગ લેનાર બેંકોના ગ્રાહકો માટે, ગ્રાહકોના તુરેત વ્યવહાર હેતુ કાયાનિવત કરવામા આવે છે. ગ્રાહકના વ્યવહારોના પ્રત્યેક કાયવાહિ દ્વારા, કેન્દ્રિક એડવાઈસ મળ્યાની સાથે, ગ્રાહકના ખાતામા કોઈ પણ માનવીય દસ્તાવેજ વગર રકમ જમા થઈ જશે. આના કારણે સ્ટોક એક્સટેન્જો ખાતે ટી+1 સેટલમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ થઈ જશે. 72 બેંક્સ સાથે સંક્ષિપ્ત શીયાલ 32 બેંકો આ સુવિધા દ્વારા તેના ગ્રાહકોને 840 બાંચો પર, દેશના 134 મોટા સેન્ટરો પર આરટીજઅસ સંબંધીત ફંડ ટ્રાન્સરને સેવા પુરી પાડશે.

આરબીઆઈ એમ પણ જણાવે છે કે કેન્દ્રિક મેળવતી બેંક કેન્દ્રિક નોટીઝીકેશન મળ્યાના બે કલાકની અંદર ગ્રાહકના ખાતામા રશી જમા લેવાની રહેશે. આરટીજઅસ ની આ સેવા આપતી બેંક્સની યાદી આરબીઆઈ ની વેબસાઈ (www.rbi.org.in) ની આરટીજઅસ લીંક પર ઉપલબ્ધ છે.

અહીં જણાવવાનું કે માર્ચ 26, 2004 ના રોજ આરબીઆઈ ની આરટીજઅસ સિસ્ટમની શરૂઆત થઈ હતી. 29 એપ્રિલ, 2004 થી આ સેવા ગ્રાહકના વ્યવહારો માટે પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આરટીજઅસ એક વ્યવસ્થિત તથા અગત્યની ભુગતાનની પદ્ધતિ છે કે જે દેશના બેંકેંગ તથા દ્વિતીય સંસ્થાનોને આવરી લે છે. આ એક સુનિયોજિત ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર પદ્ધતિ છે. કે જે બેંકો બેંક તથા બેંક ગ્રાહકો વચ્ચેના વ્યવહારોના રીયાલ ટાઇમ ઓનલાઈન સેટલમેન્ટનું કાર્ય કરે છે. જે તમામ શિડ્યુલડ બેંક્સ કે જે તેઓના ગ્રાહકોને આ સેવાઓ લાવિ આપે તેઓ આરટીજઅસ ના મેમ્બર થઈ શકે છે. હાલ દેશની 72 જિલ્લો બેંક્સ ઇન્ટર બેંક સેટલમેન્ટ માટે આરટીજઅસ ની મેમ્બર છે. આ બેંકો મુખ્યના 90 ટકા થી વધુ ઇન્ટર બેંક ટ્રાન્સેક્સનોની બરાબરી કરે તેટલું કાર્ય કરે છે.

અલ્યુના કિલ્લાવાલા
મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ રિલીઝ: 2004-2005/188